




III 2

- ☞ Wiehan de Jager
- ☞ Southern African Folktale



ଜ୍ଞାନ ପ୍ରକାଶନୀ



<https://creativecommons.org/licenses/by/3.0/>

Attribution 3.0 International License.

This work is licensed under a Creative Commons




- ☞ Wiehan de Jager
- ☞ Southern African Folktale

ଜ୍ଞାନ ପ୍ରକାଶନୀ

[globastorybook.net](http://globastorybook.net)

**Global Storybooks**





એક દિવસ, એક સુખી કુટુંબ હતી.

].ኋና


ՅՅዕ እነ በዚ ቅዱ እነ ሰው ብ ከዚ ነኝ በተሟ  
በተሟ ገዢ ነት የስርፍ አይደንግ ይች እና በተሟ






પણ આગ પાસે જવા ની રજા નતી.

ՀԱՅ ԱՅ ԱՅ ԱՅ ԱՅ  
ՀԱՅ ԱՅ ԱՅ ԱՅ ԱՅ ԱՅ




ԱՅ ԱՅ ԱՅ ԱՅ ԱՅ ԱՅ  
ԱՅ ԱՅ ԱՅ ԱՅ ԱՅ ԱՅ






પણ એક દિવસ, એક છોકરો ને બહારે  
તડકા માં જવું તું.



પક્ષી ભાઈ લય ને એક ઊંચો પહાડ પર લય  
ગયા.

„კის ერთ მანაზე ჩავა  
დევიან ახალ ცხად წერ და გადავა ფართი.



„მარტო უფრო ფართი და გადავა ფართი და გადავა ფართი.





પણ બહુ મોહું થયું! એ તાપ માં ઓગળી  
ગયો.



એને જોય ને બીજા મીણા ના બાળકો ઉદાસ  
હતા.